

NALIN LEASE FINANCE LTD

CIN: L65910GJ1990PLC014516

Date: 08/02/2025

To,

BSE Ltd.

Phiroze Jeejeebhoy Towers 25th Floor, Dalal Street Mumbai- 400 001

Company Code 531212

Subject: <u>Publication of Unaudited Financial Results for the quarter and nine-months</u> ended on 31st December, 2024

Dear Sir(s),

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we inform you that the Unaudited Financial Results for the quarter and nine months ended on 31st December, 2024 of the Company has been published in Western Times (English & Gujarati) newspapers on Saturday, 08th February, 2025.

Copies of the said publication are enclosed for your reference.

Kindly take the same on record and acknowledge the receipt of the same.

Thanking you,

Yours faithfully,

For Nalin Lease Finance Limited,

Nikul Patel

Chief Financial Officer

Enclosure: As above

Rajoo Engineers Lays the Foundation for Manufacturing Park

Rajkot, In a historic move towards redefining India's industrial land-cluding essential facilities in advanced technolo-India's industrial land-scape, Rajoo Engineers proudly announces the initiation of its ambitious business expansion project with a Bhumi Pujan ceremony held on February 5, 2025. This significant event marks the commencement of a groundbreaking development on an 80-acre nonagricultural land, setting the foundation for India's first-of-its-kind manufacturing park dedicated to advanced manufacturing

The newly acquired land will house a comprehensive ecosystem where all verticals of Rajoo Engineers' operations will be seamlessly integrated under one roof. The project will be executed in stages, starting

ecosystems.

key operational This will be foland hubs. lowed by the integration of advanced technology units, R&D centers, and sustainability-driven operations.

The final stage will focus on consolidating all verticals to maximize efficiency, conserve resources, and ensure seamless collaboration with 100% green energy. With substantial in-

vestments dedicated to state-of-the-art infrastructure, this manufacturing park is designed to embody sustainability at its core. The project will incorporate lean manufacturing principles to minimize waste, optimize resource utilization, and promote environmentally ing advanced technologies like lot will further enhance efficiency, predictive maintenance, and resource optimization.

'This is more than just an expansion; it is a festament to Rajoo Engineers' vision for the fu-

ture.
We are creating an integrated ecosystem that promotes innovation, sustainability, and operational excellence." emphasizes Khushboo Chandrakant Doshi -Managing Director of Rajoo Engineers Limited.

scores its dedication to setting new benchmarks in India's industrial and

Hexaware Technologies IPO to open

its equity share of the face value of Rs. 1 each on Wednesday, February 12, 2025. The Anchor Investor Shares aggregating up to Rs. 8,750 crores by CA



Further, 5% of the Net QIB Category shall be available for allocation on the balance Equity Shares available for allocation in the Mutual Fund Portion

will be added to the remaining QIB Category for proportionate allocation to QIBs. All Bidders (other than Anchor Investors) ipate in the Offer through the ASBA process.

Business Brief |||

Infibeam Avenues' Subsidiary Rediff Receives TPAP License from **NPCI** for RediffPay

Gandhinagar, Infibeam Avenues Limited, a listed fintech company, is pleased to announce that its subsidiary, Rediff.com India Ltd., has been granted a Third-Party Application Provider (TPAP) license by the National Payments Corporation of India (NPCI) for its digital payment platform, RediffPay.

As per the official communication received by Rediff from National Payments Corporation of India (NPCI) on Friday, it has been informed about the approval of TPAP license and also that Axis Bank

will act as Payment System Provider (PSP) bank. Mr. Vishal Mehta, Chairman and Managing Di-rector of Infibeam Avenues Ltd., stated, "We are thrilled that our subsidiary company has received the TPAP license from NPCI, which allows us to extend UPI services through RediffPay. This milestone aligns with our vision to enhance financial inclusivity and offer seamless digital payment solutions to consumers across India.

Rate cut to spur residential demand, lower home loan rates: Industry

try on Friday welcomed the much-awaited benchmark rate cut of 25bps by the Reserve Bank of India (RBI), saying lowered interest rates will further nudge homebuyers to buy an ownership home with an upgraded lifestyle. The Central Bank's Monetary Policy Committee (MPC) cut the repo rate by 25 basis points to 6.25 per cent. RBI Governor San-jay Malhotra said the MPC has also unanimously decided to continue with a neutral stance and will focus on inflation while spporting growth. According to Boman Irani, President, CREDAI National, the decision supplements recent announcements in the Union Budget aimed at boosting spending and spur economic growth. This supportive monetary policy was imperative, especially after the recent 50-basis-point reduction in the Cash Reserve Ratio (CRR), which has already injected significant

New Delhi, Feb 7 (IANS) The real estate indus-

liquidity into the banking system, he mentioned.

sourcing, manufacturing and distributing products to the remote corners of

SANBLUE CORPORATION LTD. Reg. off: 22-A, Government Servant Society, Near Municipal Market,

C.G. Road, Ahmedabad-380009. Email: inquiry@sanbluecorporation.com • Website: www.sanbluecorporation.com

CIN: L15400GJ1993PLC020073 NOTICE Intimation of Board meeting for the Quarter ended on 31/12/2024

NOTICE is hereby given that the meeting of the Board of Directors of the Company will beheld on Wednesday, 12/02/2025 at the Registered office of the Company at 05:00 P.M:

- 1. To Consider and approve Financial Results of the Company for the quarter ended 31.12.2024
- 2. Any other businesses with the permission of chair.

Further pursuant to SEBI (Prohibition of Insider Trading) Regulations, 2015 and in compliance with the terms of Code of Conduct for Prohibition of Insider Trading, the "Trading Window" for dealing in the securities of the Company has already been closed for all Designated Persons and their immediate relatives w.e.f. 1st January, 2025 and it will continue to remain close till 48 hours after declaration of financial results for the quarter financial ended on 31/12/2024



For and on behalf of the Board of Directors

Jekil Pancholi

Company Secretary- FCS: 12329

Sanblue Corporation Limited

Place: Ahmedabad Date: 07/02/2025

MINAXI TEXTILES LIMITED

CIN: L17119GJ1995PLC025007 Regd. Office: Plot No. 3311, G.I.D.C. Phase IV, Chhatral, Tal. Kalol, Chhatral - 382729

Ph: +91-02764-234008, Email: minaxitx@yahoo.com Website: www.minaxitextiles.com

POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION FOR MEMBERS

NOTICE is hereby given that pursuant to the provisions of Sections 108 and 110 of the Companies Act. 2013 ("the Act") read with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules 2014 ("the Rules") as amended, read with General Circular numbers 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020, General Circular No. 22/2020 dated 15th June, 2020, General Circular No. 33/2020 dated 28th September, 2020, General Circular No. 39/2020 dated 31st December, 2020, General Circular No. 10/2021 dated 23st June, 2021, General Circular No. 20/2021 dated 8th September, 2020, General Circular No. 20/2021 dated 8th Se December, 2021, General Circular No. 03/2022 dated 5th May, 2022, General Circular No. 11/2022 dated 28th December, 2022, General Circular No. 09/2023 dated 25th September, 2023, General Circular No. 09/ 2024 dated 19th September, 2024 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") read with Circular numbers SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133; SEBI/HO/CFD/CFD-PoD- 2/P/CIR/2023/ 167; SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4; SEBI/HO/CFD/CMD2/CIR/P/ 2022/62; SEBI/ HO/CFD/CMD2/ CIR/P/2021/11 and SEBI/HO/CFD/CMD1/CIR/ P/2020/79 issued by the Securities and Exchange Board of India (SEBI) on 3rd October, 2024, 7th October, 2023, 5th January, 2023, 13th May, 2022, 15th January, 2021 and 12th May, 2020 respectively ("SEBI Circulars") and such other applicable laws and regulations the Company seeks approval of the Members to the resolutions set out in the Postal Ballot Notice (alongwith Explanatory Statement thereto as required under the provisions of Section 102 of the Act) dated 01st February, 2025 (Notice), by way of voting through electronic means only ("remote evoting")

In accordance with the aforesaid Circulars, Notice has been sent by electronic mode on 07th February, 2025 to those Members whose e-mail addresses are registered with the Company / Registrar & Share Transfer Agent of the Company /Depository Participants as on 31st January, 2025 ("cut-off date"). Any members who did not receive the Notice may send an email at minaxitx@yahoo.com . In compliance with the requirements of the MCA Circulars, physical copy of Postal Ballot Notice alongwith Postal Ballot Forms and pre-paid Business Envelopes will not be sent to the members for this Postal Ballot and Members are required to communicate their assent or dissent through the remote e-voting system only.

To facilitate such members to receive the Notice electronically and cast their vote electronically, members who have not registered their email addresses with the Company, please follow the below instructions to register email address for obtaining Postal Ballot Notice for remote e-voting For Members holding shares in physical mode are requested to update email address by writing to

- the Company with details of folio number along with PAN (self attested scanned copy of PAN card) at minaxitx@yahoo.com
- Members holding shares in Demat mode can get their email addresses registered by contacting their respective Depository Participants

Pursuant to the provisions Section 108, 110 and other applicable provisions, if any, of the Act, read with Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("the Listing Regulations"), MCA and SEBI Circulars, and any other applicable provisions, if any, the Company

has extended remote e-voting facility to enable the members to cast their votes electronically through the

remote e-voting services provided by CDSL. In this regard, Notice is hereby given that the remote e-voting period commences on Monday, 10th February, 2025 at 09.00 A.M. (IST) and ends on Tuesday, 11th March, 2025 at 5.00 P.M. (IST). The remote e-voting shall not be allowed beyond the said date and time. Any response received from the Members after 5.00 p.m. (IST) on Tuesday, 11th March, 2025 shall be treated as if no response is received. Shareholders holding shares either in physical form or in dematerialized mode as on Friday, 31st January, 2025 (cut-off date) may cast their vote electronically and voting rights shall be reckoned on the shares registered in the name of the member as on the cut-off date. Any recipient of this Notice who has no voting rights as on Friday, 31st January, 2025 (cut-off date) should treat this notice as information purpose only. For the process and manner of electronic voting, members may go through the instructions in the Notice of Postal Ballot or

The Board of Directors of the Company has appointed Mr. Ashok P. Pathak, Practicing Company Secretary (Membership No. ACS: 9939 and CP No. 2662) of M/s. Ashok P. Pathak & Co., Company Secretaries, Ahmedabad, as the Scrutinizer for conducting the Postal Ballot through remote a-voting process in a fair

visit CDSL's website www.evotingindia.com. Once the vote on a resolution is cast by member, the

member shall not be allowed to change it subsequently

www.bseindia.com.

Place: Chhatral

Date : 07.02.2025

Members may kindly note that the Chairperson or any other person duly authorized by the Chairperson will announce the result of the Postal Ballot on or before 13th day of March, 2025, at the Registered Office of the Company situated at Plot No. 3311, GIDC Phase IV, Chhatral, Tal. Kalol, Chhatral, Gujarat 382729. The aforesaid results of the Postal Ballot along with Scrutinizer's report will also be displayed on the: (i) Notice Board of the Company at its Registered Office; (ii) Company's website www.minaxitextiles.com (iii) CDSL website www.evotingindia.com and (iv) Stock exchange website www.bseindia.com

Contact details for remote e-voting or other queries related to Postal Ballot : The Company Secretary, Plot No. 3311, GIDC Phase IV, Chhatral, Tal. Kalol, Chhatral, Gujarat 382729. Tel. No. 9979874372 Email: minaxitx@yahoo.com. Contact details for grievances connected with facility of e-voting provided by CDSL: Mr. Rakesh Dalvi, Sr.

Manager, 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM-Joshi Marg, Lower Parel (E), Mumbai-400 013. E Mail ID-helpdeskevoting@cdslindia.com . Phone No. - 1800 21 09911. Pursuant to Regulation 47 of the Listing Regulations, the said Notice of Postal Ballot may be accessed on the Company's website at www.minaxitextiles.com, website of CDSL (e Voting Agency) www evotingindia.com and website of the Stock Exchange where the shares of the Company are listed at

> For, Minaxi Textiles Limited. Dineshkumar P. Patel Managing Director DIN: 02268757

Indian ConsumerTech market projected to reach \$300 billion by 2027 been considered for years,

Bengaluru, Feb 7 (IANS) The Indian ConsumerTech market is projected to reach \$300 billion by 2027, growing at a compound annual growth rate (CAGR) of 25 per cent, according to a report

Type of

Contract

Services

Gov.registered contractors.

Offline

Tender

Advertising • Train Interior

Misc-Static- BOXN Wagon Cleaning

Out of Home

Catalogue

No.

NFR-ADI

NFR-ADI

Sr. No.

1 to 7

Sr.No.

80

12.00 Hrs.

if possible.

and website

No.INF/BCH/541/2025

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

E-AUCTION FOR NON-FARE REVENUE CONTRACTS

With reference to above, Bids are invited on E-auction for Non-Fare Revenue

contracts of Ahmedabad Division for following <u>catalogues, which have beer</u> <u>already published on IREPS website</u>. The details are furnished as under-

Category

On Station Premise (Digital)

Train Exterior (Full Face)

Note: (1) Prospective Bidders are requested to visit the e-Auction Leasing module on IREPS website (www.ireps.gov.in) and get themselves registered to the state of the state

before participating in the auction. (2) The Lot-wise details under above mentioned Catalogue No. are available under the head of the upcoming e

auction, Zone: Western Railway, Unit: Ahmedabad Division-Commercial. (3) Initial Cooling Off period is 30 minutes. Successive Lot Closing interval is 10 minutes. Lot-wise Closing Time can be viewed in the e-Auction module of

IREPS. (4) For any queries related to scheduled auction, please reach us at srdcm@adi.railnet.gov.in or on +91-9724093968.

ADI-316

Like us on:

facebook.com/WesternRly • Follow us on:

twitter.com/WesternRly • Follow us on:

twitter.com/WesternRly

ANKLESHWAR NOTIFIED AREA

OFFICE OF THE CHIEF OFFICER,

PHONE NO.(02646) 222487

TENDER NOTICE NO.07 OF 2024-25

Online | Online tender from 10/02/2025 to

www.tender.nprocure.com and

Tender collect from 10/02/2025 to

up to 17.00 hrs. Tender opening

Other document EMD, Tender Fee, Registration copy

will be send this office from 01/03/2025 to 03/03/2025

up to 17.00 hrs. Tender opening on dt.04/03/2025 at

Tender notice will be see on this office notice board

www.statetenders.gujarat.gov.in if any inquiry

please contact this office Phone 02646-222487

GCCL INFRASTRUCTURE & PROJECTS LIMITED

(CIN: L45400GJ1994PLC023416)

17/02/2025 last date of received tender

by RPAD/Speed post only 28/01/2025

dt.18/01/2025 at 12.00 hrs. if possible.

www.nprocure.com and

Chief Officer

www.statetenders.gujarat.gov.in

Notified Area Office, Plot No.618-619, AIA Community

Centre GIDC, Ankleshwar are invited tenders from

Tender 28/02/2025 up to 17.00 hrs.

On Station Premise (Non-Digital)

On Station Premise (Non-Digital) at 12:00 Hrs. on

This report highlighted high-potential categories in the domestic market, such as health foods, pet care and "athleisure" (a hybrid style of athletic clothing typically worn as

Date & Time of

E-Auction

E-Auction for

the lots will start

at 12:00 Hrs. on

date 14-02-2025

E-Auction for

the lots will start

date 21-02-2025



everyday wear). Health foods, with a CAGR of 20 per cent, and pet care, with a 17 per cent CAGR, have been observed as fast-growth sub-segments in the emerging

brand's segment, according to the report by Chira-

CHANGE OF NAME

I have changed my old name

from **DHAMELIYA HIREN**

VITTHALBHAI to new name

PATEL HIREN

VITTHALBHAI

Add. A-18, Vijay Park

Society, Dheeraj Housing,

Seventhday School

Maninagar

Ahmedabad-380008

Google and 1Lat-

"Athleisure"

to the global markets.

to 5-6 years of the recent wave of new-age brands, and we have created a clear framework of rightto-win in specific categories," said Anoop Menon, ConsumerTech lead for Chiratae Ventures.

report sees significant opportunities to create impactful brands that address unmet consumer needs while leveraging in-novative business models.

Supply chain and dis-

TENDER NOTICE શ્રી લીંચ મહાજન પાંજરાપોળ મુ.પો.લીંચ સ્ટે.જગુદણ, તા. જી. મહેસાણા (ઉ.ગુ.) પીન:૩૮૪૪૩૫ Work Location: Linch Mahajan Panjrapole @ Bore Branch Sr.No. **Details For Work** Tentative masonary Wall-1200 RFT(approx) Note: Please refer

Kindly collect tender copy with section from above office address during (8 AM to 12 PM) between 10 feb to 14 feb. Submit on or before 15 feb, 2025 .:-

CHANGE OF NAME

5104

I have changed my old name from RAMESHBHAI **BAHECHARBHAI PATEL** to new name RAMESHBHAI **BECHARBHAI PATEL** Add. Bunglow-5- Saharsh Villa, Koba Gandhinagar-382426

5102

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION ELECTRICAL WORK E-Tender Notice No. Sr.DEE/ADI/62 (24-25), dt.06.02.2025, Tender No.

EL-50-1-ADI-T-81-2024-25 Name o Work: Electrical work in connection with providing of desert coolers or hire basis for the period of 02 years at various locations over Ahmedabad Division. Estimated cost 74.39.065.60. Earnest Money 1,48,800/- Date and Time of Submission and opening: Not later than 15:00 Hrs of 04-03-2025 and 04-03-2025 at 15:30 Hrs. Address of the office and Website details Divisional Electrical Engineer D.R.M. Office (W.R.), Nea Chamunda bridge, Opp. G.C.S hospital, Naroda road, Amdupura Ahmedabad-382345. Website www.ireps.gov.in

E-AUCTION FOR LEASING CONTRACTS OF SLR COMPARTMENTS

The Divisional Railway Manager (Commercial), Western Railway, Bhavanagar Para invites e-Auction for leasing contracts of SLR compartments of various trains originating from Bhavnagar division through IREPS. The auction has been published on IREPS website details are as follows:-Notice Inviting e-Auction

Auction for the lease Contract of 3.9/04 tonne parcel space of SLRs :-						
Sr. No.		Comp.	Frequency	From	То	
1	09565	FSLR-I	Daily	PBR (Porbandar) BVC (Bhavnagai Terminus)		
2	09566	FSLR-I	Daily	BVC (Bhavnagar Terminus)	VRL (Veraval)	
3	09567	FSLR-I	Daily	VRL (Veraval)	BVC (Bhavnagar Terminus)	
4	09568	FSLR-I	Daily	BVC (Bhavnagar Terminus)	PBR (Porbandar)	
5	19319	FSLR	Wednesday	VRL (Veraval)	INDB (Indore)	
6	11087	FSLR-I	Saturday	VRL (Veraval)	PUNE (Pune)	
7	22990	FSLR	Thurs & Sat	MHV (Mahuva)	BDTS (Bandra Terminus)	
8	20968	RSLR-I	Tuesday	PBR (Porbandar)	SC (Secunderabad Jn.)	
9	20968	FSLR-I	Tuesday	PBR (Porbandar)	SC (Secunderabad Jn.)	
10	20968	FSLR-II	Tuesday	PBR (Porbandar) SC (Secunderaba		
11	19256	RSLR	Sun, Mon, Tue, Wed & Fri	MHV (Mahuva) ST (Surat)		

more details, log in :- www.ireps.gov.in Like us on: f facebook.com/WesternRly • Follow us on: X twitter.co

Follow us on: X twitter.com/WesternRly

Notified Area. GIDC, Ankleshwar

20.89

NALIN LEASE FINANCE LIMITED CIN: L65910GJ1990PLC014516

Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg, Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264, email: info@nalinfin.co.in, www.nalinfin.co.in

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2024 (Rs.in Lacs)

SI. No.	PARTICULARS	For the quarter ended			For the year ended
		31 Dec 2024	30 Sep 2024	31 Dec 2023	31 March 2024
		Unaudited	Unaudited	Unaudited	Audited
1.	Total Income From Operations	162.12	173.65	184.24	666.75
2.	Net Profit/(loss) for the period				
	(before Tax, Exceptional and/or Extraordinary items)	130.57	116.13	155.44	517.09
3.	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	130.57	116.13	155.44	517.09
4.	Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)	99.80	69.39	108.08	384.98
5.	Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	99.80	69.39	108.08	384.98
6.	Paid up Equity Share Capital	655.82	655.82	655.82	655.82
8.	Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-				
1.	Basic:	1.52	1.06	1.65	5.87
2.	Diluted:	1.52	1.06	1.65	5.87

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) & Company's website (www.nalinfin.co.in)



For, NALIN LEASE FINANCE LTD

Place: Himmatnagar

Date : 07-02-2025

Sd/- (H.D. Gandhi) WholeTime Director

Reg. Off.: A-115, Siddhi Vinayak Towers, B/h DCP Office, Off SG Highway, Makarba Ahmedabad-380051 Tel.: 079-29703131, Email: info@gcclinfra.com EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31 ST DECEMBER, 2024 (RS. IN. LAKHS EXCEPT EPS Quarter Ended **Particulars** 31.12.2024 30.09.2024 31.12.2023 31.03.2024 n audited) (Un audited) (Un audited) (Audited 1 Total income from operations (net) 0.18 0.19 0.19 (71.81) Net Profit /(Loss) for the period (before (8.40)Tax, Exceptional and/or Extraordinary items)

(8.72) (28.99) | Net Profit /(Loss) for the period before (8.40)(71.81)(8.72) (28.99 Tax (after Exceptional and/or Extraordinary items (74.36) (8.84) (25.50) Net Profit /(Loss) for the period after (5.47)Itax (after Exceptional and/or Extraordinary items) Total comprehensive Income for the (54.87) 6.64 (28.37 178.00 period [comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] Paid up Equity Share Capital (Face value 38.24 38.24 38.24 38.24 of Rs.10 each) Earnings per share (of Rs.10/-each) (for continuing and discontinued operations (a) Basic EPS (19.45) (2.31) (6.67 (b) Diluted EPS (1.43)(19.45) (2.31) (6.67

 The above financial results have been prepared in accordance with Indian Accounting Standards as prescribed under section 433 of the Compares Act, 2013 read With Rule 3 of the Companies Indian Accounting Standards} Rules, 2015 a The above financial Results of the Company for the quarter ended 31st December, 2024 are prepared in accordance with the Indian Accounting Standards

('Ind AS') as prescribed under Section 133 of the Companies Act, 2013 as amended 3. The above is an extract of the detailed format of audited Financial Results for the

Quarter and half year ended on 31.12.2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) egulations, 2015. The full format of the audited Financial Results are available of he Stock Exchanges web sites: www.bseindia.com For GCCL INFRASTRUCTURE & PROJECTS LIMITED Date: 07/02/2025

sd/- AMAM SHREYANS SHAH Directo DIN: 01617245

technological sectors.

This pioneering venture not only signifies Rajoo Engineers' growth trajectory but also under-

Bidding Date is one Working Day prior to Bid/Offer Opening Date, being Tuesday, February 11, 2025. The Bid/ Offer Closing Date is Friday, February 14, 2025. The Price Band of the Offer has been fixed from Rs. 674 per Equity Share to Rs. 708 per Equity Share. Bids can be made for a minimum of 21 Equity Shares and multiples of 21 Equity Shares thereafter. The initial public offering comprises an offer for sale of Equity

on Wednesday, February 12, 2025

A h m e d a b a d,
Hexaware Technologies
Limited proposes to open
an initial public offering of
its equity share of the face

for allocation on a proportionate basis to all QIBs, including Mutual Funds, subject to valid Bids being received at or above the

a proportionate basis to Mutual Funds only and the remainder of the Net QIB Category shall be available Offer Price. However, if the aggregate demand from Mutual Funds is less than 5% of the QIB Category,

the Application Supported by Block Amount process, and shall provide details of their respective bank account, including UPI ID for UPI Investors in which the Bid Amount will be blocked are not permitted to partic-

by the SCSBs or the Sponsor Banks, as the case may be. Anchor Investors

as a well-oiled machine,

the country. However, with

the onset of insurgent

brands innovating in an

agile and proactive man-

ner to capture early sig-

nals before they become

dominant trends - a deep-

er understanding of the margins that exist at each

stage of the value would

help the entrepreneurs

building in the space un-derstand the value they

can capture and scale

profitably, the report observed. "With rising cus-

tomer expectations and the changing dynamics of

how brands reach custom-

ers, distribution in India is

no longer a one-size-fits-all model. D2C brands to-

day are redefining indus-

try standards by paving

the way for more agile and efficient models," said Ab-

hilasha Jaju, Director, Fi-

nancial Investors, 1Lattice.

CHANGE OF NAME

I have changed my old name from **MAHESHKUMAR**

ARUNPRASAD NAIK to new

name MAHESHKUMAR

ARUNBHAI NAYAK

Add. 69-70. Paras Society

Odhav, Ahmedabad

shall mandatorily partici-pate in this Offer through

Magnum Holdings (the Promoter Selling Share-

tae Ventures, in collaboration with brand building and communication to appeal

can potentially reach \$7 billion by 2028 — opening exciting opportu-nities for new star-

tups to build.
The report
also highlighted categories such as lab-grown diamonds, millet-based foods and Ayurveda. For these, there is a large export market seen, right-towin emerges from technology innovation and R&D, as well as

"India has seen close

In ConsumerTech, the

tribution in India have

section drawing for masonary work that attached with tender copy

5 feet ht above GL

Ready made Cement Patiya wall 1500 RFT(approx)

-: Contact Details :-Vipulbhai M. Shah M. 8200212801 | Chetanbhai Shah M. 8450990066 Email: slmp384435@gmail.com

WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION

Type of Contract : Leasing of Parcel Space Catalogue No. : LEASE-2024-22								
Location and Asset detail								
Auction for the lease Contract of 3.9/04 tonne parcel space of SLRs :-								
Sr. No.	Train No.	Comp.	Frequency	From	То			
1	09565	FSLR-I	Daily	PBR (Porbandar)	BVC (Bhavnagar Terminus)			
2	09566	FSLR-I	Daily	BVC (Bhavnagar Terminus)	VRL (Veraval)			
3	09567	FSLR-I	Daily	VRL (Veraval)	BVC (Bhavnagar Terminus)			
4	09568	FSLR-I	Daily	BVC (Bhavnagar Terminus)	PBR (Porbandar)			
5	19319	FSLR	Wednesday	VRL (Veraval)	INDB (Indore)			
6	11087	FSLR-I	Saturday	VRL (Veraval)	PUNE (Pune)			
7	22990	FSLR	Thurs & Sat	MHV (Mahuva)	BDTS (Bandra Terminus)			
8	20968	RSLR-I	Tuesday	PBR (Porbandar)	SC (Secunderabad Jn.)			
9	20968	FSLR-I	Tuesday	PBR (Porbandar)	SC (Secunderabad Jn.)			
40	20060	ECLD II	Tuesday	DDD (Dorbondor)	CC (Cooundorahad In)			

પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય: ચેજ્ઞાઈ હાઈકોર્ટ

મદ્રાસ હાઇકોર્ટે મોટો નિર્ણય આપતાં સ્પષ્ટ કહ્યું છે કે પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય. આ સંપૂર્ણપણે વાણી સ્વતંત્રતા વિરુદ્ધ છે. એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જી. કે. ઇલાન્થિરાયને આ કડક ટિપ્પણી કરી હતી. તેમનું માનવું છે કે જો કોઈ આ રીતે પત્રકારો પર દબાણ કરી રહ્યું છે તો તે ઉત્પીડન

૨૩ ડિસેમ્બરના રોજ અજ્ઞા યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ સમગ્ર ચેન્નાઈને હચમચાવી દીધું છે. આ ઘટનાના કારણે તમિલનાડુનું રાજકારણ ગરમાવા છે. અહીં એક એન્જિનિયરીંગ સ્ટુડન્ટનું યુનિવર્સિટી કેમ્પસ પાર્સ બિરયાની વેચતા ૩૭ વર્ષીય વ્યક્તિ દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થિનીએ પોતે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી.

(એજન્સી) ચેજ્ઞાઈ, શરુઆતમાં પોલીસ આ કેસને હળવાશથી લેતાં કોઈ કાર્યવાહી કરી નુ હતી. પરંતુ જ્યારે સોશિયલ મીડિયા પર મામલો ઉછળતા પોલીસ એક્શનમાં આવી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

જુૈં દ્વારા આ મામલાની તપાસ દરમિયાન જ એજન્સીએ ઘણા પત્રકારોને સમન્સ મોકલ્યા હતા અને તેમને પ૦થી વધુ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં તેઓ વિદેશમાં ક્યાં-ક્યાં ગયા હતા અને તેમની પાસે કેટલા પૈસા છે. આ ઉપરાંત પણ ઘણા અંગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એવામાં હવે જ્યારે કોર્ટને આ બાબતે ખબર પડી ત્યારે કોર્ટે પત્રકારોની તરફેણમાં દલીલ કરી હતી. જસ્ટિસ જી કે ઇલાન્થિરાયને કહ્યું કે જો પત્રકારો પાસેથી અંગત ડેટા માંગવામાં આવે છે, તેમની પાસેથી અંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો આ માત્ર પ્રેસને હેરાન કરવાનો એક માર્ગ છે. આ પ્રેસ કાઉન્સિલ ઍક્ટની કલમ ૧૫(૨)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રેસ સ્વતંત્રતા અને

ગોપનીયતા બંને એકબીજા સાથે જોડાયેલા છે. જસ્ટિસ જી કે ઇલાન્થિરાયને એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે પૂછવામાં આવેલા પ્રશ્નો ખૂબ જ અંગત હોવાનું જણાય છે અને ઑ ગોપનીયતાના અધિકારનું સીધું ઉલ્લંઘન છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે જીં પત્રકારોના અંગત પ્રશ્નો પૂછીને તેના અધિકારક્ષેત્રની બહાર ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે. આ નિર્ણય ૯ જજોની

બેન્ચે સર્વસંમતિથી આપ્યો છે.

આ કેસમાં ચુકાદો સંભળાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે અરજદારો (રિપોર્ટરો)ના મોબાઇલ ફોન જપ્ત કરવા, તેમના અંગત અને ખાનગી ડેટાની ઍક્સેસ આપવા માટે દબાણ કરવું અને અંગત અને ગોપનીય માહિતી જાહેર કરવાનું કહેવું એ પ્રેસ પર હુમલો કરવા અને દેખરેખના ડરથી તેમને ત્રાસ આપવા સિવાય બીજું કંઈ નથી.

ગેરરીતિથી મહારાષ્ટ્રની ચૂંટણી જીતી : રાહુલ ગાંધી

(એજન્સી)નવી દિલ્હી, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત અને NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં

ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા છે. ે રાહુલ ગાંધીએ કહ્યું, 'અમે આ ટેબલ પર મહારાષ્ટ્રમાં છેલ્લી ચૂંટણી લડનારા સમગ્ર વિપક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ.' અમેં ચૂંટણી વિશે કેટલીક માહિતી લાવવાના છીએ. અમે મતદારો અને મતદાન યાદીની વિગતોનો અભ્યાસ કર્યો છે. અમારી ટીમો કામ કરી રહી છે અને અમને ઘણી ગેરરીતિઓ મળી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મતદાર યાદીમાં ઘણી ખામીઓ છે. પ મહિનામાં ૭ લાખ મતદારો ઉમેરાયા. ચૂંટણી પહેલા આટલા બધા મતદારો કેવી રીતે જોડાયા? ચૂંટણી કમિશનરની ચૂંટણીની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'વિધાનસભા ચૂંટણી ૨૦૧૯ અને લોકસભા ૨૦૨૪ વચ્ચે પ વર્ષમાં ૩૨ લાખ મતદારો ઉમેરાયા.' પરંતુ, લોકસભા ૨૦૨૪ અને વિધાનસભા ચૂંટણી વચ્ચેના પ મહિનાના સમયગાળામાં, ૩૯ લાખ મતદારો ઉમેરાયા. પ્રશ્ન એ છે કે આ મતદારો કોણ છે? બીજો મુદ્દો એ છે કે મહારાષ્ટ્રમાં રાજ્યની કુલ મતદાતા વસ્તી કરતા વધુ મતદાતાઓ કેમ છે? કોઈક રીતે, મહારાષ્ટ્રમાં અચાનક મતદારોનું સર્જન થયું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ચૂંટણી પંચને કહી રહ્યા છીએ કે અમને વિસંગતતાઓ મળી રહી છે. અમને મહારાષ્ટ્રના મતદારોના નામ અને સરનામાવાળી મતદાર યાદીની જરૂર છે. લોકસભાની ચૂંટણી માટે આપણને મતદાર યાદીની જરૂર છે. અમને વિધાનસભા ચૂંટણીની મતદાર યાદીની જરૂર છે કારણ કે અમે સમજવા માંગીએ છીએ કે આ નવા નામ કોણ છે. ઘણા મતદારો એવા છે જેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે એક બૂથના મતદારોને બીજા બૂથ પર ખસેડવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના મતદારો દલિત સમુદાયો, આદિવાસી સમુદાયો અને લઘુમતી સમુદાયોમાંથી આવે છે. અમે ચૂંટણી પંચને વારંવાર વિનંતી કરી છે.

તેમણે અમને કોઈ જવાબ આપ્યો નથી. વિપક્ષી નેતાએ સંસદ ભવનમાં આ વાત કહી છે. ચૂંટણી પંચે કોઈ જવાબ આપ્યો નથી. હવે, તેઓ જવાબ નથી આપી રહ્યા તેનું એકમાત્ર કારણ એ છે કે તેમણે જે કર્યું છે તેમાં કંઈક ખોટું છે. હું કોઈ આરોપ લગાવી રહ્યો નથીં. હું અહીં ડેટા સ્પષ્ટ રીતે રજૂ કરી

NFSU ખાતે "ઇર્મિજિંગ ટ્રેન્ડ્સ ઇન ફાર્માસ્યુટિકલ સાયન્સ વીથ ફોરેન્સિક પરસ્પેક્ટિવ" વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું સમાપન

કોમેસ્ટિક, દવાઓ અને ખાદ્ય ચીજ-વસ્તુઓમાં થતી ભેળસેળ ઉપર કડક નિયંત્રણ એ પ્રાથમિકતાઃ ડો. એસ.જી. કોશિયા

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા 'ઇર્મજિંગ ટ્રેન્ડ્સ ઇન ફાર્માસ્યુટિકલ સાયન્સ વીથ ફોરેન્સિક પરસ્પેક્ટિવ' વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું સમાપન તા.૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ થયું હતું. કોન્ફરન્સના પ્રથમ દિવસે, ગુરુવારે આયોજિત ઉદ્ઘાટન સમારોહ સમારોહમાં ડૉ. એચ.જી. કોશિયા, કમિશનર-ફૂડ એન્ડ ડ્રગ નિયંત્રણ વહીવટીતંત્ર (FDCA), ગુજરાત; ડૉ. સમીર અગ્રવાલ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ-મોલેક્યુલર છૈં; ડૉ. શ્રીનિવાસ એસ. સાવલ, પ્રમુખ-IPA-GSB અને ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-દ્રહ્નજો મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. એક સોવેનિયરનું વિમોચન પણ મહાનભાવો દ્વારા ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કરાયું

ડૉ. એચ.જી. કોશિયા, કમિશનર-



ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ફોરેન્સિક ફાર્મસી નિષ્ણાતોની માંગ વધી રહી છેઃ ડો. જે.એમ. વ્યાસ

FDCAએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોમેસ્ટિક, દવાઓ અને ખાદ્ય ચીજ-વસ્તુઓમાં થતી ભેળસેળને કારણે આરોગ્ય પર થતી ગંભીર અસરો સામે કડક નિયંત્રણ માટે FDCA સક્રિયપણે કામ કરી રહ્યું છે. તેમણે સમાજની સ્વાસ્થ્ય-રક્ષા માટે ભેળસેળ સહિતની પ્રક્રિયાઓને રોકવા ફોરેન્સિક વિજ્ઞાનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. ડૉ. સમીર અગ્રવાલ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ-મોલેક્યુલર છેંએ વર્તમાન સમયમાં છૈંની ઉપયોગિતા

અંગે માર્ગદર્શન આપ્યું હતું. NFSUના કુલપતિ ડૉ. જે.એમ.

કરીને પ્રસ્થાન કરવામાં આવશે.

વ્યાસે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કોરેન્સિક કાર્મસીના નિષ્ણાતોની માંગ વધી રહી છે. ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીએ વર્ષ-૨૦૧૧માં ફોરેન્સિક ફાર્મસીનો અભ્યાસક્રમ શરૂ કર્યો હતો અને તેના ૧૪ વર્ષ પછી પણ વિશ્વભરમાં માત્ર ગણતરીની યુનિવર્સિટીઓ આ પ્રકારનો . અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવી રહી છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ફોરેન્સિક ફાર્માસિસ્ટની તત્કાળ જરૂરિયાત છે અને આ ક્ષેત્રે સંશોધન પણ એટલું જ

આ બે દિવસીય પરિષદ દરમિયાન ૫૦૦થી વધુ સહભાગીઓ જોડાયા હતા. જેમાં ફાર્માસ્યુટિકલ અને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રોના નિષ્ણાતો, સંશોધકો. શિક્ષણવિદો. ઉદ્યોગ વ્યાવસાયિકો દેશ-વિદેશના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરિષદનો મુખ્ય હેતુ ફાર્માસ્યુટિકલ વિજ્ઞાન અને ફોરેન્સિક વિજ્ઞાનમાં અત્યાધુનિક પ્રગતિઓ, નવા વલણોની ચર્ચા માટે એક મંચ પૂરો પાડવાનો હતો.

પરિષદના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્રી સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર-NFSU; પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, જુના અખાડાના નાગા સાધુઓ કેમ્પસ ડાયરેક્ટર,NFSU-ગોવા; પ્રો. ૭ ફેબ્રુઆરીથી પ્રસ્થાન કરશે. જૂના (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા મહંત નારાયણ ગિરિએ જણાવ્યું હતું કે, તેમના અખાડા દ્વારા ૭મીએ કઢી ડાયરેક્ટર, NFSU-દિલ્હી, પ્રો. (ડૉ.) મંજુનાથ ઘાટે, ડીન-સ્કૂલ ઓફ પકોડાના મિજબાની યોજાશે. ત્યાર ફાર્મેસી અને પ્રો.(ડૉ.) ભૂમિકા પટેલ, પછી સંતો દ્વારા ધર્મ ધ્વજા નીચી એસોસિયેટ ડીન-સ્કૂલ ઓફ ફાર્મસી પણ ઉપસ્થિત હતા.

'તમે ઘર તોડી શકો છો, ઇતિહાસ નહીં': શેખ હસીના

શેખ હસીનાએ બુધવારે રાત્રે ફેસબુક લાઈવ દ્વારા એવામી લીગ પાર્ટીના સમર્થકોને સંબોધિત કર્યા હતા. સંબોધન દરમિયાન તેણે કહ્યું કે તેની હત્યા માટે બાંગ્લાદેશમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મોહમ્મદ યુનુસે મને અને મારી બહેનને મારી નાખવાની યોજના બનાવી હતી. નોંધનીય છે કે સંબોધન બાદ વિરોધીઓએ શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક

આવાસ પર હુમલો કર્યો હતો. બાંગ્લાર્દેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ અવામી લીગ પાર્ટીના સમર્થકોને સંબોધિત કર્યા. જો કે, સંબોધન પછી તરત જ, માહિતી બહાર આવી કે ઢાકામાં વિરોધીઓએ શેખ મુજીબુર ઐતિહાસિંક રહેમાનના નિવાસસ્થાન પર હુમલો કર્યો. દેખાવકારોએ ઘરમાં ભારે તોડફોડ કરી હતી.શેખ હસીનાએ ફેસબુક લાઈવ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા. સંબોધન દરમિયાન તેણે કહ્યું કે તેની હત્યા માટે બાંગ્લાદેશમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. મોહમ્મદ યુનુસે મને અને મારી બહેનને મારી નાખવાની યોજના બનાવી હતી.શેખ હસીનાએ વધુમાં

CIN: L15400GJ1993PLC020073 ചിടിപ്പ

નાણાંકીય પરિણામોની મંજૂરી માટે

ર) સભાપતિની પરવાનગીથી અન્ય કોઈ કામ

યોજાવાની છે.

સ્થળ : અમદાવાદ

તારીખ : 07/02/2025

ENDED 31 ST DECEMBER, 2024

1 Total income from operations (net)

Tax, Exceptional and/or

Extraordinary items)

Tax (after Exceptional

and/or Extraordinary items

tax (after Exceptional and/or Extraordinary items)

period (after tax) and other Comprehensive Income (after tax)]

of Rs.10 each)

(a) Basic EPS

(b) Diluted EPS

mended from time to time.

Place: Ahmedabad

Particulars

Net Profit /(Loss) for the period (before

Net Profit /(Loss) for the period before

4 Net Profit /(Loss) for the period after

5 Total comprehensive Income for the

period [comprising Profit/(Loss) for the

Paid up Equity Share Capital (Face value

Earnings per share (of Rs.10/-each) (for

continuing and discontinued operations

કહ્યું કે જો આ હુમલાઓ છતાં ઘરે તોડફોડ કરી હતી. તેના ઘરની અલ્લાહે મને જીવતો રાખ્યો હોય તો કંઈક મોટું કર્યું હશે. જો એમ ન હોત તો હું આટલી વખત મૃત્યુને હરાવી શૂક્યો નૃહોત.બુલડોઝરથી ઈતિહાસ તોડી શકાર્તો નથીઃ શેખ હસીનાતેમના સંબોધન દરમિયાન તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે લોકોએ તેમના ઘરને શા માટે આગ લગાવી? હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાયની માંગ કરું છું. શું મેં મારા દેશ માટે કંઈ કર્યું નથી? શા માટે અમારું આટલું અપમાન થયું? તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં તખ્રાપલટ બાદ પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના

સામાન લૂંટી લેવામાં આવ્યો હતો. તેમનું ઘર બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું.શેખ હસીનાએ વધુમાં કહ્યું હતું કે, દેખાવકારો દ્વારા તોડફોડ કરાયેલા ઘર સાથે તેમની ઘણી યાદો જોડાયેલી છે. ઘર બાળી શકાય. પણ ઈતિહાસ ભૂંસી ન શકાય. તેણે મોહમ્મદ યુનુસ અને તેના સમર્થકોને પડકાર ફેંક્યો અને કહ્યું કે તેઓ બુલડોઝર વડે રાષ્ટ્રધ્વજ અને બંધારણને નષ્ટ કરી શકે છે, જે આપણે લાખો શહીદોના જીવની કિંમતે હાંસલ કર્યું છે. બુલડોઝરથી ઈતિહાસ ભૂંસી શકાતો નથી.

વચ્ચે રાજકીય વિવાદ પણ સર્જ્યો.

તમિલનાડુમાં ગર્ભવતી મહિલા પર બળાત્કારનો પ્રચાસ

(એજન્સી)ચેજ્ઞાઈ,

તમિલનાડુમાં બે પુરુષોએ કથિત રીતે ચાર મહિનાની ગર્ભવતી મહિલાનું જાતીય શોષણ કર્યું અને પછી તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી. જી હા.. આ ભયાનક ઘટનાએ રાજ્યના લોકોમાં આક્રોશ ફેલાયો અને વિપક્ષ અને શાસક ડીએમકે

સી.જી. રોડ, અમદાવાદ-380009

31 ડિસેમ્બર, 2024ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળાના

બોર્ડ મીટીંગની જાણ બાબત

આથી નોટિસ આપી જાણ કરવામાં આવે છે કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટરની મીટીગ

12 ફેબ્રુઆરી, 2025 બુધવારના રોજ સાંજે 5:00 કલાકે કંપનીના રજીસ્ટર્ડ સરનામે

૧) 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂર્ણ થયેલાં કંપનીના ત્રિમાસિક ગાળાના

વધમાં SEBI (પ્રોહિબિશન ઑફ ઈનસાઈડર ટેડિંગ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ના

અનુસંધાનમાં અને ઈનસાઈડર ટ્રેડિંગના નિષેધ માટેની આચારસંહિતાની શરતોના

પાલનમાં, કંપનીની સિક્ચોરિટીઝમાં વ્યવહાર કરવા માટેની અને "ટ્રેડિંગ વિન્ડો"

પહેલેથી જ તમામ નિયુક્ત લોકો તથા નજીકના સંબંધીઓમાટે બંધ કરવામાં આવી છે.

૧લી જાન્યઆરી, ૨૦૨૫ અને તે ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પરા થયેલા

GCCL INFRASTRUCTURE & PROJECTS LIMITED

(CIN: L45400GJ1994PLC023416)

Reg. Off.: A-115, Siddhi Vinayak Towers, B/h DCP Office, Off SG Highway. Makarba

Ahmedabad-380051 Tel.: 079-29703131, Email: info@gcclinfra.com

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અને વતી,

સાનબ્લ્યુ કોર્પોરેશન લિમિટેડ

Sd./-

જેક્લિ પંચોલી

કંપની સેક્રેટરી - FCS: 12329

Quarter Ended

0.18

(8.40)

(5.47)

38.24

(1.43)

The above financial results have been prepared in accordance with India

Accounting Standards as prescribed under section 433 of the Compares Act, 2013 read With Rule 3 of the Companies Indian Accounting Standards) Rules, 2015 as

The above financial Results of the Company for the quarter ended 31st December, 2024 are prepared in accordance with the Indian Accounting Standards ("Ind AS") as prescribed under Section 133 of the Companies Act, 2013 as amended

The above is an extract of the detailed format of audited Financial Results for the Quarter and half year ended on 31.12.2024 filed with the Stock Exchanges under

Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements Regulations, 2015. The full format of the audited Financial Results are available or

31.12.2024 30.09.2024 31.12.2023 31.03.2024 (Un audited) (Un audited) (Un audited) (Audited

0.19

(71.81)

(71.81)

(74.36)

(54.87)

38.24

(1.43) (19.45) (2.31) (6.67

(RS. IN. LAKHS EXCEPT EPS)

(8.72)

(8.84)

6.64

38.24

(19.45) (2.31) (6.67

0.19 20.89

(28.99

(25.50

(28.37

38.24

(8.72) (28.99

ત્રિમાસિક નાણાકીય પરિણામોની ઘોષણા પછી ૪૮ કલાક સુધી બંધ રહેશે.

આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. અહેવાલ મુજબ મહિલા આંધ્રપ્રદેશના ચિત્તૂર જઈ રહી હતી ત્યારે શુક્રવારે વહેલી સવારે ટ્રેન તિરુપત્તુર જિલ્લાના જોલારપેટ્ટાઈ પાસેથી પસાર થઈ રહી હતી. મહિલા વોશરૂમ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર હુમલો કર્યો. મહિલાએ મદદ માટે બૂમો પાડી અને सानબ्ल्यू ङोर्पोरेशन लिभिटेड વોશરૂમ તરફ દોડી, પરંતુ પુરુષોએ તેનો પીછો કર્યો અને તેને વેલ્લોર રજી. ઓફિસ : 22- A, ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી, મ્યુનિસિપલ માર્કેટ પાસે. જિલ્લામાં કોમ્બેટોર-તિરુપતિ ઇન્ટરસિટી એક્સપ્રેસમાંથી બહાર Email : inquiry@sanbluecorporation.com • Website : www.sanbluecorporation.com ધક્કો મારી દીધો હતો.

મહિલાના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માથામાં પણ ઇજા થઇ હતી. તેને વેલ્લાર જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મહિલા કોઈમ્બતુરની એક ગારમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. જોલારપેટ્ટાઈ પોલીસે કેસની ફરિયાદ નોંધી છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. ગુનેગારોને ઓળખવા માટે સૌસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં હેમરાજ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો.

ફાચર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. બધાએ એસેમ્બલી પોઈન્ટ પર (એજન્સી) પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હતી. જો કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પીપા બ્રિજ નંબર ૧૮ પાસે આગની ઘટના બની હતી. આરએએફ, યુપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં

મહાકુંભમાં સેક્ટર ૧૮માં લાગી આગ,

કેમ્પમાં આગ લાગી હતી. પત્રકારો સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હતી અને થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની વિશેષ ટીમ આગે કયા કારણોસર લાગી તે તપાસ કરી રહી છે.

લીધી હતી. સેક્ટર ૧૮, શંકરાચાર્ય

માર્ગ પર આવેલા હરિહરાનંદ

ઘટનાસ્થળે જાહેરાત કરતાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે કોઈ જાનહાનિ નથી અને બધું નિયંત્રણમાં

કોન્ટ્રાક્ટનો પ્રકારઃ પાર્સલ સ્પેસનું લિઝીંગ

FSLR-I

FSLR-II

RSLR

9 20968

20968

19256

આવવું જોઈએ. આગ લાગ્યા બાદ પોન્ટૂન બ્રિજ નંબર ૧૮ પર શ્રદ્ધાળુંઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. સેક્ટર ૧૮માં જ્યાં આગ લાગી હતી ત્યાં મોટી સંખ્યામાં સંતો અને મહાત્માઓ રહે છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે ભીડ છે. પોલીસ, આરએએફ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી, એક ટીમ તરીકે કામ કરી, કેટલાક સ્થળોએ રસ્તો બ્લોક કર્યો અને અન્ય સ્થળોએ માર્ગ ડાયવર્ટ કર્યો. આવી સ્થિતિમાં રાહતની વાત છે કે કોઈ જાનહાનિ થઈ નથી.

આગની ઘટનાના કારણે અંદાજે ૨૦ ડેટલા ટેન્ટ ખરાબ રીતે બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાંગી હોવાની શંકા છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

કેટલોગ નં. LEASE-2024-22

SC (સિકંદરાબાદ જં.)

SC (સિકંદરાબાદ જં.)

ST (સુરત)

SLR કમ્પાર્ટમેન્ટ્સના લિઝીંગ કોન્ટ્રાક્ટસ માટે ઈ-હરાજી ડિવિઝનલ રેલવે મેનેજર (કોમર્શિયલ), પશ્ચિમ રેલવે, ભાવનગર પરા IREPS દ્વારા ભાવનગર ડિવિઝન થી ઉપડર્ત ટ્રેનોના SLR કમ્પાર્ટમેન્ટ્સના લિઝીંગ કોન્ટ્રાક્ટસ માટે ઈ-હરાજી આમંત્રિત કરે છે. હરાજી IREPS વેબસાઈટ પર

પશ્ચિમ રેલવે – ભાવનગર ડિવિઝન

પ્રકાશિત કરવામાં આવેલ છે. વિગતો નીચે મજબ છે ઈ-હરાજી આમંત્રિત કરતી સૂચના

લેઝ કોન્ટ્રાક્ટ માટે હરાજી
ીં થી અહીં સુધી
પોરબંદર) BVC (ભાવનગર ટર્મિનસ)
નગર ટર્મિનસ) VRL (વેરાવળ)
વેરાવળ) BVC (ભાવનગર ટર્મિનસ)
નગર ટર્મિનસ) PBR (પોરબંદર)
વેરાવળ) INDB (ઈન્દોર)
વેરાવળ) PUNE (પૂણે)
(મહુવા) BDTS (બાંદ્રા ટર્મિનસ)
પોરબંદર) SC (સિકંદરાબાદ જં.)

(1) ઈ-હરાજી તા.21-02-2025 ના 11:00 કલાક થી શરૂ થશે (2) હરાજીમાં ભાગ લેવા માટે IREPS ઈ-હરાજી લિઝીંગ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે. (3) વધુ વિગતો માટે <u>www.ireps.gov.in</u> પ

PBR (પોરબંદર)

PBR (પોરબંદર)

MHV (મહુવા)

કુંભમાંથી વિદાયનો આરંભ શરૂ (એજન્સી) પ્રયાગરાજ, પરંપરાગત ઉજવણી સાથે ઠાકુરજીને ખસેડ્યા પછી ધર્મ ધ્વજા નીચી કરી મહોકુંભ મેળાનું સત્તાવર દેવામાં આવશે.

અંતિમ અમૃત સ્નાન પછી અખાડાઓની

સમાપન ૨૬ ફેબ્રુઆરીના રોજ થઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં કુંભને આંગવી ઓળખ આપનારા ૧૩ અખાડાઓ વિદાય લઈ રહ્યા છે. પ્રસ્થાનના સંકેત સ્વરૂપે સૌ પ્રથમ

તેમણે પોતાની ધજાઓ નીચી કરી દીધી છે. સોમવારે વસંત પંચમીના રોજ છેલ્લા અમૃત સ્નાન પછી અખાડાઓએ પરંપરાગત કઢી પકોડાના ભોજન સાથે મહાકુંભ નગરીમાંથી નીકળવાની તૈયારી કરી લીધી છે.૧૩ અલગ-અલગ અખાડામાં શિવ ઉપાસક સન્યાસી, રામ-કૃષ્ણને સમર્પિત બૈરાગી અને પંચદેવના સાધક ઉદાસીનનો સમાવેશ થાય છે. મંગળવારે બેરાગી પંથના પંચ નિર્વાણી અખાડામાંથી ૧૫૦ જેટલા સંતો રવાના થયા હતા અને હવે માત્ર ૩૬ રહ્યા છે. અયોધ્યાના હનુમાનગઢી સાથે સંકળાયેલા પંચ નિર્વાણી

લેસ્ટર્ન ટાઇમ્સ

અખાડાના મહંત રાજુદાસે કહ્યું હતું કે,

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત જાહેરાતો અંગે વાંચકોએ પોતાની રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

-જાહેરખબર મેનેજર

Franklin Templeton Mutual Fund

Cordially invites you for a program under it's Investor Education and Awareness Initiative.

Banquetoria, The Junomoneta Tower, 301-303, opp. Pal RTO BRTS Road, Adajan Gam, Adajan, Surat 395009

> Date: 10th February, 2025 Time: 3:30 p.m

Contact Person: Jigar Desai (9725043004)

Due to limited seats, entry will be provided to registered attendees only. Please call on the above number to register by tomorrow We look forward to your participation



Registered office: One International Centre, Tower 2, 12th & 13th Floor,

Mutual Fund investments are subject to market risks.

મીનાક્ષી ટેક્ષટાઈલ્સ લીમીટેડ

CIN: L17119GJ1995PLC025007

૨જી. ઓફિસઃ પ્લોટ નં.૩૩૧૧, જી.આઇ.ડી.સી., ફેઝ-૪, છત્રાલ, તાલુકાઃ કલોલ, ગાંધીનગર-૩૮૨૭૨૯, ફોનઃ +૯૧-૦૨૭૬૪-૨૩૪૦૦૮ Email: minaxitx@yahoo.com Website: www.minaxitextiles.com

સભ્યો માટે પોસ્ટલ બેલેટ નોટિસ અને ઈ-વોટિંગ માહિતી

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ)ની કલમ ૧૦૮ અને ૧૧૦ ની જોગવાઈઓ અનુસાર, જે કંપનીઓ (વ્યવસ્થાપન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ (નિયમો) ના નિયમો ૨૦ અને ૨૨ની સાથે વાંચી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તા. ૮ એપ્રિલ, ૨૦૨૦ , સામાન્ય પરિપત્ર નંબર ૧૭/૨૦૨૦, તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નંબર ૨૨/૨૦૨૦, તા. ૧૫મી જૂન, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નંબર ૩૩/૨૦૨૦, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નંબર ૩૯/૨૦૨૦, તા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૦, સામાન્ય પરિપત્ર નંબર ૧૦/૨૦૨૧, તા.૨૩મી જૂન, ૨૦૨૧, સામાન્ય પરિપત્ર નંબર ૨૦/૨૦૨૧,તા. ૮મી ડિસેમ્બર, ૨૦૨૧ સામાન્ય પરિપત્ર નં. ૦૩/૨૦૨૨, તા.૫મી મે,૨૦૨૧, સામાન્ય પરિપત્ર નં. ૧૧/૨૦૨૨, તા.૨૮મી ડિસેમ્બર, ૨૦૨૨, સામાન્ય પરિપત્ર નં. ૦૯/૨૦૨૩, તા.૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૩, સામાન્ય પરિપત્ર નં.૦૯/૨૦૨૪ , તા.૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૪ ("MCA પરિપત્રો") પરિપત્ર નંબરો SEBI/ HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133; SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167; SEBI/HO/ CFD/PoD-2/P/CIR/2023/4; SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62; SEBI/HO/CFD/CMD2/CIR/P/ 2021/11 અને SEBI/HO/CFD/CMD1/CIR/ P/2020/79 સિક્ચોરિટીઝએન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા અનુક્રમે ૩જી ઓક્ટોબર, ૨૦૨૪, ૭મી ઓક્ટોબર, ૨૦૨૩, ૫ જાન્યુઆરી, ૨૦૨૩, ૧૩ મે, ૨૦૨૨, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ અને ૧૨મી મે, ૨૦૨૦ (SEBIના પરિપત્રો) સાથે વાંચી તેનું અને અન્ય તમામ લાગુ પડતા કાયદાનું પાલન કરતા, કંપની ૧લી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજની પોસ્ટલ બેલેટ નોટિસ (કંપની અધિનિયમ ૨૦૧ ૩ની કલમ ૧૦૨ની જોગવાઈ હેઠળ જરૂરી સ્પષ્ટતાત્મક નિવેદન સાથે) ("નોટિસ")માં દર્શાવેલ નિર્ધારિત ઠરાવો માટે સભ્યોની મંજૂરી માત્ર ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન ("રિમોટ ઈ-વોટિંગ")થી માંગેલ છે.

આવા સભ્યોને ઇલેક્ટ્રોનિક રીતે નોટિસ પ્રાપ્ત કરવા અને ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરવાની સુવિધા આપવા માટે, જે સભ્યોએ કંપનીમાં તેમના ઇમેઇલ સરનામાં નોંધાવ્યા નથી, તેઓ રિમોટ ઇ-વોટિંગ માટે પોસ્ટલ બેલેટ નોટિસ મેળવવા માટે ઇમેઇલ સરનામું નોંધાવવા માટે કૃપા કરીને

ભૌતિક રીતે શેર ધરાવતા સભ્યોને minaxitx@yahoo.com પર ફોલિયો નંબર અને PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાણિત સ્કેન

કરેલી નકલ) ની વિગતો સાથે કંપનીને ઇમેઇલ સરનામું લખીને અપડેટ કરવાની વિનંતી છે. ડીમેટ મોડમાં શેર ધરાવતા સભ્યો તેમના સંબંધિત ડિપોઝિટરી સહભાગીઓનો સંપર્ક કરીને તેમના ઇમેઇલ સરનામાં નોંધણી કરાવી શકે

સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ (લિસ્ટિંગ રેગ્યુલેશન્સ), એમસીએ અને સેબી પરિપત્રોના નિયમન ૪૪ સાથે વાંચવામાં આવતી કાયદાની કલમ ૧૦૮, ૧૧૦ અને અન્ય લાગુ જોગવાઈઓ, જો કોઈ હોય તો, કંપનીએ સીડીએસએલ દ્વારા પૂરી પાડવામાં આવતી રિમોટ ઈ-વોટિંગ સેવાઓ દ્વારા સભ્યોને ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરવા સક્ષમ બનાવવા માટે રિમોટ ઈ-વોટિંગ

આ સંદર્ભમાં, નોટીસ આપવામાં આવે છે કે રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો સોમવાર, ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે (IST) શરૂ થશે અને મંગળવાર, ૧૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે (IST) સમાપ્ત થશે. રિમોટ ઈ-વોટિંગ ઉપરોક્ત તારીખ અને સમય પછી માન્ય રહેશે નહી. મંગળવાર, ૧૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે (IST) પછી સભ્યો તરફથી મળેલ કોઈપણ

પ્રતિભાવને કોઈ પ્રતિભાવ મળ્યો ન હોય તેવું માનવામાં આવશે. શુક્રવાર, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ (કટ-ઓફ તારીખ) ના રોજ ભૌતિક સ્વરૂપમાં અથવા કિમટીરિયલાઈઝુડ મોડમાં શેર ધરાવતા શેરધારકો ઇલેક્ટ્રોનિક રીતે તેમનું મતદાન કરી શકે છે અને મતદાન અધિકારો કટ-ઓફ તારીખે સભ્યના નામે નોંધાયેલા શેર પર ગણવામાં આવશે. આ નોટીસ મેળવનાર કોઈપણ પ્રાપ્તકર્તા જેમને શુક્રવાર, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ (કટ-ઓફ તારીખ) સુધી મતદાનનો અધિકાર નથી, તેમણે આ નોટીસને ફક્ત માહિતીના હેતુ માટે ગણવી. ઇલેક્ટ્રોનિક મતદાનની પ્રક્રિયા અને રીત માટે, સભ્યો પોસ્ટલ બેલેટની નોટીસમાં આપેલી સૂચનાઓ વાંચી શકે છે અથવા CDSLની વેબસાઇટ www.evotingindia.com ની મુલાકાત લઈ શકે છે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મતદાન થઈ જાય, પછી સભ્યને તેમાં ફેરફાર કરવાની મંજરી આપવામાં આવશે નહી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શ્રી અશોક પી. પાઠક એન્ડ કો.ના શ્રી અશોક પી.પાઠક, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી (સદસ્ય નં. ACS: ૯૯૩૯

અને CP નં. ૨૬૬૨) અમદાવાદ,ની નિમણુક સ્કુટિનાઈઝર તરીકે રિમોટ ઈ-વોટિંગ પ્રક્રિયા દ્વારા પોસ્ટલ બેલેટનું સંચાલન નિષ્પક્ષ અને

સભ્યોએ કૃપા કરીને નોંધ લેવી કે અધ્યક્ષ અથવા અધ્યક્ષ દ્વારા યોગ્ય રીતે અધિકૃત અન્ય કોઈપણ વ્યક્તિ ૧૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ અથવા તે પહેલાં કંપનીના પ્લોટનં. ૩૩૧૧, GIDC ફેઝ IV, છત્રાલ, તા. કલોલ, છત્રાલ, ગુજરાત ૩૮૨૭૨૯ ખાતે સ્થિત રજિસ્ટર્ડ ઓફિસમાં પોસ્ટલ બેલેટનું પરિણામ જાહેર કરશે. પોસ્ટલ બેલેટના ઉપરોક્ત પરિણામો સ્ક્રુટિનાઇઝરના રિપોર્ટ સાથે નીચે મુજબ પ્રદર્શિત કરવામાં આવશેઃ (i) કંપનીના રજિસ્ટર્ડ ઓફિસ ખાતેના નોટિસ બોર્ડ; (ii) કંપનીની વેબસાઇટ www.minaxitextiles.com (iii) CDSL વેબસાઇટ www.evotingindia.com અને (iv) સ્ટોક એક્સચેન્જ વેબસાઇટ www.bseindia.com. રિમોટ ઈ-વોટિંગ અથવા પોસ્ટલ બેલેટ સંબંધિત અન્ય પ્રશ્નો માટે સંપર્ક વિગતોઃ કંપની સેક્રેટરી, પ્લોટ નં. ૩૩૧૧, જીઆઈડીસી ફેઝ IV,

છત્રાલ, તા. કલોલ, છત્રાલ, ગુજરાત ૩૮૨૭૨૯. ટેલિફોન નં. ૯૯૭૯૮૭૪૩૭૨ ઇમેઇલઃ minaxitx@yahoo.com. સીડીએસએલ દ્વારા પૂરી પાડવામાં આવતી ઈ-વોટિંગ સુવિધા સાથે જોડાયેલી ફરિયાદો માટે સંપર્ક વિગતોઃ શ્રી રાકેશ દલવી, સિનિયર મેનેજર, ૨૫મો માળ, એ વિંગ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ્સ કમ્પાઉન્ડ, એનએમ-જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ -૪૦૦ ૦૧૩. ઈ મેઈલ આઈડી-helpdeskevoting@cdslindia.com. ફોન નંબર - ૧૮૦૦ ૨૧ ૦૯૯૧૧.

લિસ્ટિંગ રેગ્યુલેશન્સના નિયમન ૪૭ અનુસાર, પોસ્ટલ બેલેટની ઉપરોક્ત નોટીસ કંપનીની વેબસાઇટ www.minaxitextiles.com, CDSL (e Voting Agency) ની વેબસાઇટ www evotingindia.com અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ જ્યાં કંપનીના શેર લિસ્ટેડ છે તે www.bseindia.com પર ઍક્સેસ કરી શકાય છે.

સ્થળ : છત્રાલ

તારીખ : ૦૭.૦૨.૨૦૨૫

મીનાક્ષી ટેક્ષટાઈલ્સ લીમીટેડ, વતી દિનેશકુમાર પી.પટેલ મેનેજીંગ ડાયરેક્ટર

ડીન નં. ૦૨૨૬૮૭૫૭



RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2024 (Rs.in Lacs)

email: info@nalinfin.co.in, www.nalinfin.co.in **EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL**

NALIN LEASE FINANCE LIMITED

CIN: L65910GJ1990PLC014516 Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg, Dr.Nalinkant Gandhi Road,

Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264,

મંગળવાર

રવિ, સોમ,

SI. No.				or the quarter ended	
		31 Dec 2024	30 Sep 2024	31 Dec 2023	31 March
		Unaudited	Unaudited	Unaudited	2024
1.	Total Income From Operations	162.12	173.65	184.24	Audited 666.75
2.	Net Profit/(loss) for the period				
	(before Tax, Exceptional and/or Extraordinary items)	130.57	116.13	155.44	517.09
3.	Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	130.57	116.13	155.44	517.09
4.	Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items)	99.80	69.39	108.08	384.98
5.	Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)	99.80	69.39	108.08	384.98
6.	Paid up Equity Share Capital	655.82	655.82	655.82	655.82
8.	Earnings Per share (of Rs 10/- each) (for continuing and discontinuing operations)-				
1.	Basic:	1.52	1.06	1.65	5.87
2.	Diluted:	1.52	1.06	1.65	5.87

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) & Company's website (www.nalinfin.co.in)



Place: Himmatnagai

For, NALIN LEASE FINANCE LTD Sd/- (H.D. Gandhi) WholeTime Director

the Stock Exchanges web sites: www.bseindia.com For GCCL INFRASTRUCTURE & PROJECTS LIMITED sd/- AMAM SHREYANS SHAH Director Date : 07-02-2025